



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૩૦/૦૪/૨૦૧૯ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૭૪૮/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૩ કેસ કરી, ૨૩ વ્યક્તિઓને ઝડપી, ૧૧૦ લીટર દેશી દારૂ, ૪૮ બોટલ ઈંગ્લીશ દારૂ, ૧ રિક્ષા અને ૧ સ્ફટક કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૪ કેસ કરી ૨૧ વ્યક્તિઓની અટક કરી રોકડ રૂપિયા ૭૩,૦૮૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૭૪૯/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૨૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પાસા હેઠળ ૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૭૫૦/૧૯

સાયબર ક્રાઇમ: પીનાકીન જગદીશચંદ્ર અમીન (ઉ.વ.૪૨)(રહે.લલિતા કો.ઓ.સોસાયટી, લોટસ સ્કુલ પાછળ વિરાટનગર ઇસનપુર) એ તા.૨૯/૦૪/૧૯ નારોજ સાયબર ક્રાઇમ ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૦/૦૪/૧૯ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન મોબાઇલ નંબર ૭૦૬૫૨૧૫૨૪૩ તથા ૯૫૫૭૪૬૮૪૫૮ ના ધારકે "પોતે એસ.બી.આઇ. ક્રેડીટકાર્ડ ડીપાર્ટમેન્ટ માંથી વાત કરતા હોવાનું કહી પીનાકીનભાઈને વિશ્વાસમાં લઈ તેમના ક્રેડીટકાર્ડ તેમજ મોબાઇલ ફોનમા આવેલ ઓ.ટી.પી.નંબરની વિગતો મેળવી લઈ, ક્રેડીટકાર્ડમાંથી કુલ રૂપિયા ૫૧,૬૨૮/- નું ટ્રાંજેક્શન કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી વી.બી.બારડ ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૭૫૧/૧૯

સોલા હાઇકોર્ટ : ગૌતમભાઈ ડાહ્યાભાઈ પટેલ (ઉ.વ.૬૨) (રહે. ભાગવતનગર સોસાયટી, ગુલાબટાવર રોડ, જે.જી.ઇન્ટરનેશનલ સ્કુલની બાજુમાં, સોલા) એ તા.૩૦/૪/૨૦૧૯ નારોજ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૬/૦૪/૨૦૧૯ સવારના ૬/૦૦ થી તા.૩૦/૦૪/૨૦૧૯ સવારના ૬/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે મંદીરના રૂમની બારી તોડી, બે અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, બેડરૂમની બે લોખંડની તીજોરી તેમજ ઉપરના બેડરૂમની ત્રણ તીજોરીના તાળા તોડી, (૧) ચાંદીના સેટ નંગ-૧૫ કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦/- (૨)સોનાનો હાર કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦/- (૩)રોકડા રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- (૪)જેન્ટસ ઘડીયાલ નંગ -૧૪ કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦/- (૫)લેડીઝ ઘડીયાલ નંગ-૦૯ કિંમત રૂપિયા ૮૦,૦૦૦/- (૬) ૧૦૦૦ યુ.એસ.ડોલર જેની કિંમત રૂપિયા ૬૯,૦૦૦/- તેમજ ૭૮૦ ઓસ્ટ્રેલીયન ડોલર જેની કિંમત રૂપિયા ૪૦,૫૬૦/- તેમજ જરૂરી દસ્તાવેજો મળી કુલ રૂપિયા ૧૬,૮૯,૫૬૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.જે.હુણ ચલાવે છે.

સાબરમતી: સ્વપ્નીલભાઈ કંચનભાઈ શાહ (રહે.મણીભદ્ર એપાર્ટમેન્ટ, હિરાજૈન સોસાયટી પાસે રામનગર સાબરમતી) એ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૮/૦૪/૧૮ કલાક ૯/૧૫ થી રાતના ૮/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, તિજોરીમાંથી સોનાના દાગીના કિંમત રૂપિયા ૨,૫૦,૦૦૦/- મતાના ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી એ.જે.દેસાઈ ચલાવે છે.

સરદારનગર: હરપાલસિંહ છત્રસિંહ ઝાલા (રહે.નોબલનગર પદ્માવતી સ્કુલ પાસે સતાભાઈની ઘંટીની બાજુમાં નોબલનગર સરદારનગર) એ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૯/૦૪/૧૮ કલાક ૦૦/૧૫ થી ૪/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના ધાબાની સીડી વાટે અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના, કપડા અને મોબાઇલ ફોન મળી કુલ કિંમત રૂપિયા ૭૦,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી જે.જી.ધીલ્લોન ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૭૫૨/૧૯

ગોમતીપુર: પુજાબહેન ડો/ઓ જગજીવનભાઈ પરમાર (ઉ.વ.૨૨) (રહે. બાઈ પાર્વતીની ચાલી ખાડાવાળી ચાલી હરવાણીના દવાખાના પાસે ટોપી મીલ પાછળ ગોમતીપુર) એ અગમ્ય કારણસર તા.૨૯/૦૪/૧૯ કલાક ૧૨/૪૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે છતના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ગોમતીપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ. શ્રી એસ.એમ મેકવાન ચલાવે છે.

ખોખરા: અમીતભાઈ વિઠલભાઈ ઢગે (ઉ.વ.૨૩) (રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી ખોખરા) એ અગમ્ય કારણસર તા.૨૯/૦૪/૧૯ સાજના ૭/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ખોખરા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ. શ્રી આર.પી.મકવાણા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.